

Date: November 10, 2023

To

BSE Limited The National Stock Exchange of India Limited

P J Towers, "Exchange Plaza",

Dalal Street, Bandra – Kurla Complex,

Mumbai – 400 001 Bandra (E), Mumbai – 400 051

Scrip Code: 541450 Scrip Code: ADANIGREEN

Dear Sir,

Sub: Newspaper Advertisement - Notice of Extra Ordinary General Meeting through Video Conferencing / Other Audio Visual Means ("VC / OAVM") facility and Remote E-voting information

Please find attached herewith copies of newspaper advertisements published in the Indian Express (English) and Financial Express (Gujarati) on November 10, 2023, both newspapers having electronic editions, intimating that the Extra Ordinary General Meeting ("EGM") of the Company will be held on Tuesday, December 05, 2023 at 11:00 a.m. through VC / OAVM facility and information regarding remote e-Voting for the EGM of the Company in terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 (as amended) and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

You are requested to take the same on your record.

Thanking You

Yours Faithfully,

For, Adani Green Energy Limited

Pragnesh Darji Company Secretary

Adani Green Energy Limited Adani Corporate House, Shantigram, Nr Vaishno Devi Circle, S G Highway Khodiyar, Ahmedabad 382 421 Gujarat, India CIN: L40106GJ2015PLC082007 Tel +91 79 2555 5555 Fax +91 79 2555 5500 investor.agel@adani.com www.adanigreenenergy.com

Dakshin Gujarat Vij Company Limited CIN U40102GJ2003SGC042909 Rajpipla Division Office Old Power House, Rajpipla 393 145 GUJARAT

DGVCL Toll Free No. 19123 (or 1800 233 3003). Tender Notice No. RJPLD/0&M/EXP/23-24/E-62 Adv.No.10 Tenders are invited for turnkey contract (supply, installation, testing and commissioning) of creation of Robust Network for 11 kV XLPE HT cable with underground /overheadcable in various sub-divisions of Rajpipla Division under S.I. Scheme

EE (O&M), Rajpipla Division Office, DGVCL. Install MCB/ ELCB/ RCCB & Prevent Electric Shocks/ Electrical Accidents

for FY 2023-24. The details are available on https://dgvcl.com

and https://tender.nprocure.com.

Dakshin Gujarat Vij Company Limited CIN U40102GJ20035GC042909

Rander Division FP: 37 TP: 32, Beside Jalaram Mandir, L P Savani Road, Adajan, Surat

DGVCL Toll Free No. 19123 (or 1800 233 3003)

Tender Notice

Tenders (nos. 19004) are invited for turnkey contract (supply, installation, testing and commissioning) of creation of Robust Network for XLPE HT cable with underground /overhead cable in various sub-divisions of Rander Division under S.I. Scheme for Fy 2023-24. For further details, vendors may visit https://nprocure.com for view, download and online submission of the tenders.

EE (O&M), Rander Division, DGVCL. Install MC8/ELCB/RCCB & Prevent Electric Shocks/ Electrical Accidents



GUJARAT METRO RAIL CORPORATION (GMRC) LIMITED

(SPV of Govt. of India and Govt. of Gujarat) Block No.1, First Floor, Karmayogi Bhavan, Sector 10/A. ani viel) 42) Gandhinagar: 382018, Gujarat. (CIN): U80259GJ2018SGC059407

TENDER NOTIFICATION No: GMRCIO&M/TRACTION/SAFETY NET/2023 Date: 10.11.2023

E-Tender is invited from reputed and experienced Contractors for the following tender:

Tender Name	Tender Fees
Tender for Design, Procurement, Supply, and Installation of Safety Net on all sides of APRD RSS of Gujarat Metro Rail Corporation Ltd Phase-I	INR

Interested bidders are requested to visit https://tender.nprocure.com for eligibility criteria, applying/ downloading the tender document Last date and time for Bid Submissions is 15:00 Hrs on 02-12-2023. Any alterations in Eligibility Criteria cum Qualification Requirements. and terms of the Tender Document, or any amendment to the Tender Document, etc., will be uploaded on https://tender.nprocure.com and GMRC's Website www.gujaratmetrorail.com without any

obligation or press notification or other proclamation. Sdf-Managing Director, GMRC, Gandhinagar

TENDER NOTICE NO:09/2023-24 (ONLINE) NIVIDA NARMADA, WATER RESOURCES, WATER **SUPPLY & KAPLSAR**

IN THE NAME OF GOVERNOR OF GUJARAT STATE THE EXECTUTIVE ENGINEER, PANCHAYT AT IRRIGATION DIVI-SION, ROOM NO. 116, DISTRICT PANCHAYT BHUJ-KACHCHH (PH:02832-220240/251879) is inviting online tender from govt. registered contractor agency must have to submit attested copies of valid registaration certificate fresh solvency pan card & work on hand statement with all necessary document & fee and EMD by scanning online & physiccally

Sr. No.	Details	Schedule
1	last date & time for online submission of tender	Date:24/11/2023 up to 18:00 hours
2	Last date & time for online submission of tender	Date:24/11/2023 up to 18:00 hours
3	Last date & time for online submission of tender fee, EMD & other supporting document	Date:24/11/2023 up to 18:00 hours
4	date of opning tender online (if possible)	Date:04/12/2023 up to 18:10 hours(if possible)

bid documnet & other details for the work will be available on our website http://www.nprocure.com for any query please contacts our above mentioned office. (DDI-KUTCH-748-2023/24)

ASHTASIDHHI INDUSTRIES LIMITED

(FORMERLY KNOWN AS GUJARAT INVESTA LINVTED) CIN: L17100GJ1993PLC018858

Registered Office: 257, New Cloft Market, Opp. Raipur Gate. Ahmedatud-360002, Gujarat. E-Mail ID: gujarat investa (jirgmail.com - Website: www.gujaratinvesta.com.

NOTICE OF EXTRAORDINARY GENERAL MEETING AND INFORMATION OF E-VOTING

Notice is hereby given to the Members of Ashtasidhhi Industries Limited (Formerly known as Gujarat Invests Limited) that the Extra Ordinary General Meeting (EGM) of the Company will be held on Thursday, December 07, 2023 at 11:00 a.m. at 252, New cloth market, OPP Raipur Gate, Ahmedabad-380002 to transact the business mentioned in the Notice convening the said Meeting, which is being sent to the Members.

The Notice of the EGM has been sent by email to all those members of the Company whose email IDs are registered with the Company / Depository Participants.

REMOTE E-VOTING INFORMATION

Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 29 of the Companies (Management and Administration) Rules, 2014, and Regulation 44 of the SEB (LODR) Regulation 2015 the Company is providing its members the facility to exercise their right to vote by electronic means ("remote e-voting"), as provided by National Securities Depository Limited ("NSDC"), on all resolutions as net out in the Notice of the EGM.

- a) Date and time of commencement of remote e-voting: Monday, December D4th 2023 at 9.00 a.m.
- b) Date and time of the end of remote e-voting: Wednesday, December OSTs
- c) Cut-off dide for determining the eligibility to vote: Friday, December 01st
- d). Those persons who have acquired shares and have become members of the Company after dispatch of notice of EGM by the Company and whose names appear in the Register of Members of the Company / in the statement of beneficial owners maintained by depositories as on cut-off date can exercise their voting rights through Remote e-voting by following the procedure as: mentioned in the said Notice of EGM.
- Manner of casting vote on resolutions at the venue of EGAt: The facility of voting through Ballot Paper shall be made available at the venue of EGM. Members who have already cast their vote by remote e-voting prior to the EGM can attend the EGM but shall not be entitled to cast their vote again at the
- Notice of EGM is available on the Company's website www.gujaratinvesta.com and on the website of BSE. Members are requested to go through the notes set out in the Notice of EGM
- for the manner of casting votes through Remote E-Voting and to attend EQM. For, Ashtasidhhi Industries Limited

(Formerly known as Gujarat Investa Limited) PURUSHOTTAM RADHESHYAM AGARWAL DIRECTOR

Date: 06.11.2023 Place: Ahmedabad (DIN:00396869)

DISHMAN CARBOGEN AMCIS LIMITED

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Half Year ended 30-09-2023

CIN : LT49093.22007PC.0051338 Ernall ID : prinsprint/traductions Web : prinsprinted.com

li. Ri	Partiesian	For The Quarter anded 39-09-2923 Sexuation	For the Proceeding Quarter ended 30-06-2023 Honelited	For the Corresponding Quarter ended 30-09-2022 Boundled	For The Bull Year coded 26-02-2023 Unapplied	Fee The Corresponding Half You ended 30-09-2022 Department	For The Near andred 21-03-2022 Audited
†:	Total bucons have specified (set)	186.58	723.36	873.96	1.308.91	1.194.87	2,412.80
8	Ret Profit/Look) for the parted (beton tax, beingslungt antion Edmandhary Reter)	0121	21.0	(0.29)	0.70	(12.10)	646
1	Net Productions) for the period belong tax softer Engaphosal and/or Entraccionary Jerses	(3620)	21.0	(12,29)	(6.77)	152,346	194.80
4	Net Proditi(Lase) for the period after tax (ofter Exceptional and/or Extraordinary Assis)	(60,50)	97.00	criticitis	(23.90)	8.00	126.005
	Trace Comprehensive tracese for the period (Compreheng Pould / (Loca) for the period Latter tank and Other Comprehensive known patter tank)	(96.52)	87.70	20.41	(38.82)	300	20674
į.	Egylly Store Digital	31.36	15.38	31.30	31.38	31.76	31.36
Ŧ.	Resides contralleg revolution reserves	100	100			1	5.778.11
t.	Secortina Premium Account						AZBAZE
ħ.	Net south				9.776.69		3,100.17
3ñ	Paid or Self Captur Systemskry Retr		75		1,291/00		1.824.51
11	Cutstanding Redomistric Protoning Sterie.	144	NA.	366	8.6	34.	.54
Ü.	Detri Equity Hatta: (Nantan of Anne)	0.34	3.34	1.0	8134	1.0	321
SE	Earnings Per Stary (of As.21- mole) (for continuing and chondrined operations) -						
- 1	Sec	0.01	1.9	(0.84)	0.95	(6.00)	(1.93)
	Ownice	(2.81)	3.08	(0)64)	(1.52)	(0.301)	(1.90)
14	Carta Repropries Reserve		- 1	- 1	1.3		- 1
35	Desertion Redistrying Reserve	100	-		11		
16	Debt Service Divinings Rolls	1.00	2.33		2.34		2.87
47.	Heterota Bernica Cororago Rallo	4.20	4.21	-	4.28	-	3.18

For the other bis Seria referred to requisition \$2(4) of the ISSN Listing and Other Dischause Requirements Proprietance, 2015 ("Listing Regulations.") perferent dischanges have been made to the black fluxuage(s) RES Control and Malbook Stand Exchange of India Control and and can be according on the sovie bredvale com: and stone revisalità com-

for states of a footbols. The Processis results pateriative and connectabled; have been received by the Audit Connectes and taken on record by the Board of Disposes at their mentings held on the foreston, 2021. Times translat results (standalone and caracillustics) have been prepared to compliance with the All as matter and the Ministry of Corporate Affairs and prescribed under Section 130 of the Consporate Add, 2013, read-with retreated vision and ethics

The regard on set profit four, total competitional in order or any other schools frames density due to change in a consisting policies what he discussed

The spocified borns of the objections from all results of the company are given dates:

5-4	harmonia de la companya del companya del companya de la companya d	100-1000-0		1,000,000		Reports to Craves /	in Yes Millioni
St. Ba	Particulars	For The Quarter anded 80-89-2023	For The Proceeding Quarter coded 83-94-2223	For the Corresponding Souther codes 30-05-2022	For The Ball Year ended 10-09-2023	For the Corresponding Bull Year maked 80-05-2022	For the Year soded 21-49-2023
_		Unaudited	Brasiler	Draubled.	Measified	Unsudited	hulited
4	Tuttoori	81.72	83.10	300.54	120.27	211.60	400.55
1	Professions between tax	(9.26)	333.021	(24.7%)	142,251	(65.48)	.298,200
6.	Set Profesional Alexan	(5.78)	.(21,00)	(57.26)	(27.11)	142.13	(58.87)
40	Tallal Comprehensive House (After Tag)	(3.46)	(13.28)	(80.80)	(16.63)	(73.00)	(117,44)

The provision quarter / year figures have been re-grouped, re-cool and re-entanged wherever uproblem in receptary to make it consquerable The above is an extract of the detailut towart of the carebone and completeled francial result, for the quarter and half your result fraptions 25, 2025 that with the Study Embryon under Requisitors, 22 and 52 of the SSS (Linky and Otto) Duranter Regulators/std Regulators, 2015 (Linky Regulations's. The full hervest of the absolution and concentrated Supercommunity for the quarter and half-year orded Expression 20, 2022, and exactlying or the Block Exchanges wend by "www.burnsta.com, and work-reloided com and set the Company's westate now endoat.com.

For and an behalf of the board.

Argelt J. Vyssa Global Managing Director Plener, Vitznan

adani

Adani Green Energy Limited Renewables

NOTICE OF THE EXTRA ORDINARY GENERAL MEETING

NOTICE is hereby given that the Extra Ordinary General Meeting (EGM) of Members of Adani Green Energy Limited will be held on Tuesday, December 05, 2023 at 11.00 a.m. through Video Conference ("VC")/Other Audio Visual Means ("OAVM"), to transact the business set out in the notice for the EGM ("Notice of EGM") in compliance with applicable provisions of the Companies Act, 2013 read with rules issued thereunder, and MCA issued General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020, General Circular No. 20/2020 dated May 5, 2020, General Circular No. 22/2020 dated June 15, 2020, General Circular No. 33/2020 dated September 28, 2020, General Circular No. 39/2020 dated December 31, 2020 and General Circular No. 21/2021 dated December 14, 2021 ("MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/CMD1/CIRP/ 2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 issued by the Securities Exchange Board of India ("SEBI Circulars"), without the personal presence of the members at the meeting, to transact the businesses, as set out in the Notice convening EGM circulated for convening the EGM.

The Company has sent the Notice convening EGM on November 09, 2023s through electronic mode to the Members whose small addresses are registered with the Company and/or Depositories in accordance with aforesaid MCA Circulars and SEBI Circulars. The requirement of sending physical copies have been dispensed with vide the MCA Circulars and SEBI Circulars. Notice convening EGM is also available on the website of the Company at www.adanigreenenergy.com and on the website of National Securities Depository Limited (NSDL) at www.evoting.nsdl.com.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Members are provided with the facility to cast their votes on all resolution as set forth in the Notice convening EGM using electronic voting system (e-voting) provided by NSDL. The voting rights of Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on November 03, 2023 ('Cut-off date').

In case Member(s) have not registered their e-mail addresses with the Company/ Depository, please follow the below instructions to register e-mail address for obtaining login details for e-voting.

- a. For members holding shares in Physical mode please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by e-mail to investor agel@adani.com.
- b. Members holding shares in Demat mode can get their E-mail ID registered by contacting their respective Depository Participant or by e-mail to investor.agel@adani.com with details of DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card). AADHAR (self-attested scanned copy of

Members holding shares in either physical form or in dematerialized form as on the Cutoff date, may cast their vote electronically on the special business matters set out in the Notice through remote e-voting of NSDL. Members are informed that:

- All the special business matters set out in the Notice will be transacted through voting by electronic means only.
- The remote e-voting shall commence on Friday, December 01, 2023 at 9,00 a.m. IST. c. The remote e-voting shall end on Monday, December 04, 2023 at 5,00 p.m. IST.
- d. Any person who becomes a member of the Company after the date of sending the notice of this EGM and holding shares as on the cut-off date, may obtain the login ID and password by sending a request to evoting@nsdl.co.in or investor agel@adani.com. However, if the person is already registered with NSDL for remote e-voting, then the existing login ID and password may be used to cast the vote.
- Members will not be able to cast their vote electronically beyond the date and time mentioned above and the remote e-voting module shall be disabled for voting by NSDL
- f. Once the vote on a resolution is cast by the member, he/she shall not be allowed to change it subsequently or cast the vote again.
- g. Members who have voted through remote e-voting will be eligible to attend the EGM. However, they will not be eligible to vote at the EGM.
- h. Only those Members, who will be present in the EGM through VC/OAVM facility and have not cast their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system in

In case you have any queries or issues regarding e-voting, you may refer to the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evoting.nsdl.com, under help section or write an email to evoting@nsdl.co.in or call toll free number 1800-222-990.

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Ms. Sarita Mote, Assistant Manager, National Securities Depository Limited, Trade World, 'A' Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai - 400013 at the designated email address saritam@nsdl.co.in or call on 022-24994890.

The details of EGM are available on the website of the Company at www.adanigreenenergy.com, NSDL at www.evoting.nsdl.com, BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com.

Place: Ahmedabad Pragnesh Darji Date: November 09, 2023 Company Secretary

Registered Office: "Adami Corporate House", Shantigram, Nr. Vaishno Devi Circle.

For, Adami Green Energy Limited

S. G. Highway, Khodiyar, Ahmedabad - 382421, Gujarat, India hone No.: +91-79-2656 5555 I Fax No.: +91-79-2555 5500

Website: www.adanigreenenergy.com | CtN: L40106GJ2015PLC082007

THE INDIAN EXPRESS, FRIDAY, NOVEMBER 10, 2023

RAJVI LOGITRADE LIMITED

(Former Name: Suryakrupa Finance Limited) CIN: L60200GJ1986PLC083845

Regd. Office: Plot No. 267, Ward 12/B, Gandhidham, Gujarat-370201

Email: investor@rajvilogitrade.com Website; www.rajvilogitrade.com Contact; 9979898027 ATCMENT OF INVALIDITED CINANCIAL DECILITY FOR OUARTED CHOCK ON

(Rs. to Lak								
Particulars	Quarter ended 30.09.2023	Hadf Year ended 30.09.2023	Year ended 31.03.2023					
	Unaudited	Unaudited	Audited					
Total Income from Operations (net)	654.50	1703.44	1613.65					
Net profit for the period (before Tax, Exceptional and Extraordinary items)	8.85	25.42	22.93					
Net Profit for the period after tax. (after Exceptional and Extraordinary Items.)	6.85	19.42	17.93					
Equity Share Capital Face Value of Rx.10:- each)	100	100	100					
Earnings Per Share - Basic/ Diluted	0.68	1.94	1.79					

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (LSDR) Regulations, 2015. The full format of the quarterly financial results are evaluable on the Stock Exchange withith: www.tneindia.com and also un Company's website at www.ratringitrade.com.

For, Rajvi Logitrade Ltd.

Jagdish Dodia Date 09/11/2023 (Managing Director & CEO)

SHREE AUT PULP AND PAPER UMITED

Regil. Office: Survey No. 239, Near Moral Ballway Crossing, Village Salvay, via-Vapi-396293. E-mail: Investoral/Livera (Lorin, Website: www.shreegit.com, Tel.ins. 0260-468570), Fax no. 6260-2487700. Ob. (220000), 1990-1276100 Extract of Consolidated Unaudited Financial Results for the Quarter and Six months ended 30th September, 2023

Sreso	Particulars	3 months ended (30/09/2023)	6-months ended (10/06/2023)	Corresponding 3 months ended (80/09/2022)
		Unaudited	Unicidited	Unsodited
1	Total income from operations	5,809.97	14,397.30	30,623.64
2	Profit before Yax	242.26	632.85	326.55
3	Profit for the period	314.12	380.97	329.55 212.90
4	Total Comprehensive Income for the period	135.33	383.06	294.46
. 5	Equity Share Capital	535.67	535.67	535.67
.6	Other figuity		- 4	at the
.7	Earnings per share Basic and Oiluted (B-not annualized)	2.13	7.11	4.35

(Face value of \$10 per share)

1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 13 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Quarterly Financial Results are available on the Company's website 'www.shreeajit.com" and Borribay Stock Exchange's website "www.bseindia.com".

The summarised standalone financial results of the company are as below > (2 in Labb)							
Particulars	3 months ended (30/09/2023)	6 months ended (30/05/2023)	Corresponding 3 months ended (30/09/2022)				
	Unaudited	Unaudited	Unaudited				
Total Income from operations	6,809.97	34,397.3G	30.623.44				
Profit before Tax	226.32	586.50	341.67				
Profit for the period	98.40	358.07	286.21				
Total Comprehensive Income for the period	99.61		347.77				
E							

For and on Hehalf of Board of Directors 547

Gautam D Shah Chairman and Managing Director DIN: 00397319

JINDAL

Date > 09 November, 2023

Place - Vagil

CIN: L17110GJ1986PLC008942

Regd. & Corp. Office: "Jindal House", Opp. Dmart, I.O.C Petrol Pump Lane, Shivranjani Shyamai 132 Ft Ring Road, Satellite, Ahmedabad – 380015 Phone: 079-71001500 • E-Mail Id: csjindal@jindaltextiles.com • Website : www.jindaltextiles.com

JINDAL WORLDWIDE LIMITED

STATEMENT OF STANDALONE & CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS (AS PER SCHEDULE III OF COMPANIES ACT, 2013 AND IND-AS) * For the Quarter & Half Year Ended 30" September, 2023 *

П		Q	luarter End	ed	Half Yea	r Ended	Year Ended
Sr.	Particulars	3 months anded of C.Y.	Preceding I north ented	Corr. 2 months anded in P.Y.	6 months ended of C.Y.	6 months ended of P.Y.	Previous Feuros Year ended
No	T di diculai s	36" Sept. 2323	31" June, 2823	30" Sept., 2022	36" Sept., 2003	38" Sept., 2022	31" March, 2023
Ш		(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Un-Audited)	(Audited)
		51	ANDALON	Œ	-		
1,	Total income from operations (net)	40064.42	41882.38	50023.82	81948.80	117094.20	215050.52
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and) or Extraordinary items)	1525.75	1910,46	3814.00	3436.21	9277,38	15195.72
3.	Net Profit (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items).	1525.75	1910.46	3814.00	3436.21	9277.38	15195.72
4.	Net Profit / (Loss) for the period after tax (after exceptional and / or Extraordinary items)	1217.90	1353.40	3050.62	2571.30	7119.39	11411.09
5.	Total Comprehensive excess for the period after share of profit after associates and minority interest (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	1217.90	1353.40	3060.62	2571.30	7119.39	11411.09
6.	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31" March 2023.	NA.	NA.	.NA	NA	NA.	62695.39
8.	Earnings per share (of Rs. 1/- each) (for continuing and discontinued operations): 1. Basic:	0.61	0.67	1.52	1.28	3.55	5.69
	2. Diluted	0.61	0.67	1.52	1.28	3.55	5.69
Г		C	ONSOLIDA	TED			
1.	Total income from operations (net)	39227.05	41115.51	47828.26	80343.56	111837.32	207149.88
2	Net Profit/(Loss) for the period (before Tax Exceptional and / or Extraordinary terms)	1626.23	1930.52	4092.55	3556.75	9676.44	15404.95
35	Net Profit/ (Loss) for the period \ before tax (after Exceptional and / or Extraordinary items).	1626.23	1930.52	4092.55	3556,75	9676.44	15404.95
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and / or Extraordinary items)	1275.50	1369.25	3272.02	2644.75	7442.37	11571.57
5	Total Comprehensive income for the period after share of profit after associates and minority interest (Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax))	1275.61	1369.29	3272.06	2644.80	7442.59	11622.08
6.	Equity Share Capital	2005.20	2005.20	2005.20	2005.20	2005.20	2005.20
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet as at Previous Financial Year ended 31" March 2023	NA.	NA:	NA	NA.	NA.	62992.50
8.	Earnings per share (of Rs. 1/- each) (for continuing and discontinued operations): 1. Basic:	0.64	0.68	1.63	1.32	3.71	5,77

operations): 1. Basic

2. Dissed

The above Un-Audited Standalone & Consolidated Financial Statements of the Company for the quarter & half year ended 30th September, 2023 have been reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 8" November, 2023.

2. The Company has adopted, Indian Accounting Standards prescribed under Section 133 of the Companies Act, 2013 ("Ind-AS") from 1" April, 2017 and accordingly these financial results and all the periods presented have been prepared in accordance with the recognition and measurement principles laid down in IND-AS 34 "Interim Financial Reporting" read with relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India and discloses the information required to be disclosed in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 (as amended).

The Statutory Auditors of the Company have carried out a Limited Review of the above Standalone & Consolidated Financial Statements of the Company for the quarter & half year ended 30" September. 2023 in terms of Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015 and have issued an unmodified Limited Review Report

4. The figures for the corresponding previous periods have been regrouped/rearranged wherever necessary, to make them comparable

5. The above is an extract of the detailed format of Un-Audited Standalone & Consolidated Financial Results for the guarter and half year ended 30" September, 2023 filed with the Stock Exchanges (BSE & NSE) under Regulation 33 of the SEBI (LODR) Regulations, 2015. The detailed statement of Financial Results. alongwith Standalone & Consolidated Independent. Limited Review Report is available on the website of BSE Limited (www.bseindia.com), National Stock Exchange of India Limited (www.nseindia.com) and also on the website of the Company (www.jindaitextiles.com). For and On Behalf of the Board For JINDAL WORLDWIDE LIMITED

Date : 8" November, 2023 Place: Ahmedabad

AMIT AGRAWAL Vice Chairman & Managing Director DIN: 00169061

Ahmedabad | | |

5.77

रुप्तराचार, शुक्रचार, वा. ५० नवेम्पर, २०२३

ફાયનાન્સિયલ એક્સપ્રેસ



3		A CONTRACTOR OF	(કપીએસ ક્રિલ	ઘથ લાખોમાં ફ
•H	વિત્રત	સિમાસિક ગાળાના 30.04.1013	444 43 444 444	पालवा वर्षे ३०.०१.१०११ म्हे अनुस्य त्रष्ठ महिन्द पुरः बद्ध
		धनचेतिहेड	*1626#	अनम्बद्धिः
1	કામગીરીમાંથી કુલ બાવક (નેટ)	C804.8Y	BERLOG	10001.10
ş	સમદગાળ માટે ચેખ્બે નકો (કર પહેલાં, બસાચારણ બને/બસવા અસાચારણ વસ્તુઓ)	11(6.01	¥406.44	097.40
3	કર પહેલાંના સમયગ્રાળા માટે ચોપ્ખી નક્ષે, (અસધારણ અને અથવા અસધારણ વસ્તુઓ પછી)	1816.08	Y106.41	667.40
8	કર પછીના સમયગાળા માટે ચીખનો નક્ષે (અસપારણ અને અથવા અસાધારણ વસ્તુઓ પછી:	641.3Y	300LAL	404.00
ų	સમયગાળા માટે કુલ વ્યાપક આવક (કર પછી) અને અન્ય વ્યાપક આવક (કર પછી)	-	3027.04	1
5	માર્કામાં કાર્ય કિક્સ	60.46	60.46	60.46
3	પાછલા વર્ષની બેલેન્સ શીટમાં બતાવ્યા પ્રમાણે અનામત (પુન મૃલ્લાંકન અનામત સિવાય)		21233.00	•
c	ઇક્વિટી શેર મુડીનું ફેસ વેલ્લુ	1,00	1,00	1.00
e	શેર દીઠ કમાણી (અસાધારણ વસ્તુઓ પહેલાં અને પછી) મુળભૂત / પાતલ	6.08	JY.VY	6.04

📲 ઇ પરીક્ત ડેટકા (હિસ્ટિંગ અને અન્ય ડિસ્કલો) પ્રર જરૂરીયા તો) રેગ્યુલેશન્ય 2015 ના નિયમન 33 ફેઠળ સ્ટોક એક્સચેન્જમાં કાઇલ કરાયેલ ત્રિમાસિક નાણાકીય પરિણામીના વિગતવાર ક્રોમેંટનો એક અર્ક છે. ત્રિમાસિક નાણાકીય પરિણામોનું સંપૂર્ણ ક્રોમેંટ સ્ટોક એક્સચેન્જ પર ઉપણબ્ધ છે. સ્ટીક એક્સચેન્જ વેબસાઇટ એટલે કે www.bsrindle.com અને કંપનીની વેબસાઇટ www.shrijapdamba.com. **ની જવાંબા પોલિયર્સ વિવિટેડ**

CLEAN OF 41 SOSS HAVE MARIOUS



रीपाल ओड़िस, समहायाह धी शावित व्यक्तिकात क्षेत्र विषे, शिष्टाता क्षोदिक कामहावाद । कोको सात, शाकार - VII, लेक्द्र क्षीप चंत्रसल, स्मासम होत, लवहंत्रपुटा, винелие, музил - эсовое, ala d. 000-254c4500, 4000 dan : m101B@uit.co.in

RO-AHM/0777/SH/SAR/SALE/68/2023-24, Date: 07.11.2023 परिशिष्ट - ४-को (लिक्स c(f)) खावर मिलक्तीना वेदाशा मार्ट हेन्डर कम क्शपुर वेदाशा नोटीश એકાઉન્ટ નં. મે. નિમા ફેરાત (પ્રો. થી મતોષ કતીશાલાલ શર્મા), શાખા-મણીતગર

શિક્ષ્યોરિટાઈ તેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓક કાયનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્કોસમેન્ટ ઓક શિક્ષ્યોરીટી ઇન્ટરેસ્ટ (અધિનિયમ) ૨૦૦૨ તથા શિક્ષ્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્કોસંમેન્ટ) રૂસ્સ, ૨૦૦૨ ના નિયમ ૮(૮) ની જોગવાઈ તેઠળ સ્થાવર મિલકનોનું હરાજથી વેચાણની વેચાણ માટેની ટેન્ડર ક્રમ લોકશન વેચાળ નોટીસ.

આવી જાહેર જવતાને સામાન્ય રીતે અને ખાસ કરીને ઉધારકનાં અને જમીનાદરોને સૂચના આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ સ્થાવર મિલકત **હી સાઉલ ઇન્ડિયાન હોંક કર્સ, માલીનગર શા**લા (મુક્સર દેવાદારો) પાસે ચીરો / ચાર્જ કરેલ છે, જેનો કારકાર કલાએ તા. રક.૧૯.૨૯૨૩ ના રોજ છી nda diisan de Rollès, Avon Milèn, Ancor (4522 Éaste) es milèn અધિકારી દારા શેવામાં આવી છે જે "જે જેમ છે ત્યાં છે" "જેમ છે તેમ" અને "જે ત્યાં છે તેમ" (સુરશ્રીત સંપત્તિઓનાં અસત્ય, પ્રકૃતિ અને ખીતિક રિથતીમાં સંદર્બે) વેગાશ કરવામાં આવશે. *ત*ા. १५.९२.२०२३ ला रोफ प्रयोदे ६२.०० पांग्या (पैत्रावाली तारोभ) भी सावित्र विस्तान पाँउ तिजीरेंड, मधीनगर थाना, शीवटीप दिस्डींग, जीशास्टीकेंश श्रेन्डनी पासे, मारीनगर रेखे સ્ટેશનની સામે, મલીનગર, અમદભાદ - ૩૮૦૦૦૮ (વેચાલનું સ્થમ) ની ૨૭૫ની વસૂજાત ધારે ની રકંપ રૂદ ૨,૪૮,૪૧,૨૦૫.૦૨ (રૂપિયા છે કરોડ ઇઠયોલેર લાખ છેલાલીસ હવાર છરસો પાંચ અને પૈસા છે પુશ) તા. ૦૧.૧૧.૨૦૨૩ સુપીના, બાકી અંદર્શ રકમને કારણે લોન એકાઉન્ટ મે. નિમા કેશન (પ્રોપ્રાઈટર - શ્રી ચનોજ કનેયાલાય શર્મા, શભા - મશીનગર ડારા ઉપારકર્તામાં પાસેથી ગડત વ્યાજ, કોસ્ટ અને ખર્ચાઓ (મુક્સર દેવાદાર) સાથે (**૧). બી મતોજ ક્ર્યોલાલાલ દાર્મા (લોલાઈટર** : મે. નિમા **કેશન).** ૨૦૫, શીવદિય એવન્યું, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૪૪૩ અને અહીં પછા બી-૪૨, રાજરત્યા બંગલોડા, થોડાસર, એમ.બી. પટેલ કાર્ય તાઉસની પાસે, અમદાવાદ - ૩૮૦૦૫૦ **અને અહીં પક્ષ**ા બી-૭૭, ઉપાસના રાજમાત્ર સોસાયડી, પોડાસર કેનાલ રોડ, અમદાવાદ - ૩૮૦૦૫૦ **અને** જામીનાદારો : - (૨). શ્રીમતી શરોપદોન ધર્મ @ શરોપદેવી ધર્મ @ ધર્મ ઇરોપદેવી કનેંચલાલ, ૨૦૫. શીવદિય એવન્યુ, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૪૪૩ **અને અહીં પછ**ા બી-૪૨, રાજરાના ભેગ્લોઝ, થોડાસર, એમ.ભી. પટેલ કાર્મ તાઉસની પાસે, અમદાશાદ - ૩૮૦૦૫૦ સાતે અહીં પણ : બી-૭૦, ઉપાસના રાજભાગ સોસાયટી, ધોડાસર કેનાલ રોડ, અમદાવાદ - ૩૮૦૦૫૦, (૭). **લીમતી વિમાણ શર્મા**, ૨૦૫, શીવદિય એવન્યુ, અમદાવાદ, ગુજરાત - ૩૮૨૪૪૩ **અને અહીં પણ**ા બી-૪૨, રાજરત્વા બંગ્લોઝ, ઘોડાસર, એમ.બી. પટેલ કાર્ય તાઉસની પાસે, અમદાવાદ - ૩૮૦૦૫૦ **અને અહીં** um : બી-ક્ક, ઉપાસના રાજમાત્ર સોસાયટી, ધોડાસર કેનાલ શેડ, અમદાવાદ - કે૮૦૦૫૦. कलामत किंमत : ३१. ५,३५,००,०००/- (अंडे ३१. क्वेड क्वोड क्वेडपीश ताम पुरा) रक्ते क्वॉव्ट મની કિપોઝીટ : ટ્રા. ૧૩,૧૦,૦૦૦/- (અંકે ટ્રા. તેર લાલ દસ કબર પુરા).

(भिवक्तना माविकनुं नाम : भी मनोष क्रतेशाया सर्मा कर्ते शरोपधेन समी) મિલકતાનું વર્શાત: મનોજ કરેવાલાલ દાર્યા અને સરોજખેન દાર્યા ની માલીકીનો તમામ ભાગ અને વિસ્તા સાથેની જમીનનું શેત્રકળ ૧૯૪.૮૨ રહે.થી. મિલ્લીંગ સાથે, બી.૪૨, અન્ય તથાય માંધકામાં, સુધારાઓ તેના પર અસ્તિત્વમાં રહેલા અને અનુરૂપ સરળતાના અધિકારો સાથે, રાજરાન (પોડાસર) કો. આં. નાઇસીંગ સોસાપટી લિ. પી જાલીની રહીય, જે સ્થિત જપીવનો સર્વે નં. ૧૮, ૧૧, ૧૨ પૈકી, એક.પી. નં. ૧૧૬, ટીપીએસ નં. ૪૫, એમ.પી. પટેલ કાર્યાની પાસે, ઘોડાસર ગામ, નામુકો - સીટી, હવે મલીનગર, જલ્લો - અમદાવાદ, વેચાલ દીદ નં. ૯૯૦૯/૨૦૦૯, તા. Or. ૧૨.૨૦૦૯, સભ રજસ્ટ્રાર ઑકિસ - અમદાવાદ - ૫ (નારોવ). **પ્રતુઓમા**ા- **ઉત્તરે** : સેડ, **દવિતર્ક** : કર્લાનલ પ્લાંટ નં. ૧૨૫ (ચંદન સોસાયટી), પૂ**ર્વે** : સેડ, પશ્ચિમે : યુનિટ નં. ખી-૪૧. (લેંકને જાણમાં લોજો : નથી)

વેચાલના વિગતવાર નિયમો અને શરનો માટે, કૃષા કરીને સાઉથ ઈન્ટિયન મેંક લિમીટેડ (મુકરર દેવાદાર), વેખસાઈટ: www. southindianbank.com માં આવેલી સિકનો સંદર્ભ લો साधिकृत साधिकारी, की शाविक व्यक्तिकार होंग जि



EURO INDIA FRESH FOODS LIMITED Formets Vesion as Cure India Freet Foods Private Limited

Reg office A-2211, 1010 game GDC, History Maydale Foret, Sone 394515, Guard, India. CN LISKIGGISSPLOST78 Eine D mentediscredution con Natistic was remediated to Princ 031-291301-391.

Extract of Unaudited Financial Results for the Quarter and Half Year ended September 30 2023

			(Rs. in Laikhe.	except EPS)
SI. No.	Particulars	Quarter ended on 30 9 2023 (Unaudited)	Half Year ended on 30.9.2023 (Unaudited)	Quarter ended on 30.9.2022 (Unaudited)
1.	Revenue from Operations	2689	5477	3893
2	Profit before Exceptional Items and Tax	82	126	45
2.	Profit before Tax	82	126	45
4.	Profit for the period	82	126	45
5.	Total Comprehensive Income (after Tax)	82	128	49
6.	Paid up Equity Share Capital (of Rs. 10 each)	2480	2480	2480
7.	Earnings per Equity Share			
	(a) Basic - Weightage	0.33	0.51	0,18
	(b) Diluted			

"Reserves for the year ended March 31, 2023, were Rs. 3849 Lakhs

- 1) The above is an estract of the detailed format of Financial Results for the Quarter and Half Year ended September 30, 2023, filed with the Stock Exchange under Regulation 33 of SEIII (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the Quarter and Half Year ended September 30, 2023, is available on the website of the National Stock Exchange of India Limited at www.neemdia.com and the website of the Company at www.euroindishods.com
- 2) The above Unaudited Standalone Financial Results for the Quarter and Half Year ended September 30, 2023, were reviewed and recommended by the Audit Committee and subsequently approved by the Board of Directors at their Meeting held on Wednesday, November 06, 2023.
- 3) The Limited Review as required under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the Statutory Auditor of the Company

For EURO INDIA FRESH FOODS LIMITED

84 Place: Surat. Javnika Gandharva Date: November 08, 2023 Company Secretary & Compliance Officer



કેમક્સ એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ

સી.આઇ.એન : એલ૦૧૧૧૦૭જે૧૯૯૬પીએલસી૦૧૯૩૧૯ રજિ.ઓફિસ: ૩૩૦, ટ્રિવિયા કોમ્પલેશ, નટુભાઇ સર્કલ, રેસકોર્સ, વડોદરા-૩૯૦૦૦૫ Bac girishshah@chemcrux.com 회리: 6억도보-국민군모군03/국민군단03

desired: www.chemonux.com ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા વિમાસિક અને અર્થ વર્ષના અનમોડિટેડ સ્ટેન્ડઅલોન

		લણાકીય પરિ	વાયોની નિવ	Set.	રુપિયા વાખો	માં શેર દીઠ કા	राप्ती सियाय
Т	Bud	કવાદિવા અને				न्द्र व्यंते	वर्षना अंदे
14		કર્યા શકેલ્લા કરક ક્યારેલ એક અનાનેડિટ	ડાન્કી ચૂન કુનાડ ક્યારેલના માને ત્યનમાં ડિટેડ	રામી સપ્ટેમ્બા કુંબર મ્યારેશના અંતે (અનમ્પીડિટેડ)	તાની શહેલ્લા સના સમામ શહેર અર્થ વર્ષ અંતે અનીડિટેડ	કાની કારોબા સ્વર સ્પાલ શકેર અર્પ વર્ષ અંતે અનેડિટેડા	(6)(5)(5)
1	HN1000 pa HISE (42)	1,500,52	1,177,69	1,005,00	61,1756	4411.04	WELD, YN
Ł.	સમયવાળા માટે ચીખ્યો નકી/ નુકશ્ચન કર પહેલા, (બપવાદદુપ અને / અથવા બસાધારણ વસ્તુઓ)	106.01	31771	490.66	YYY,YO	4,058.0N	1,077.00
4.	સંવયગાળા થારે ચેખ્બો નકો! નુકરાન કર પહેલા, (સ્વયાદદુધ અને / અથવા અસાધારકા લાનુઓ પાકી)	106.31	21331	V95.68	Yex.ye	1,078.0%	1,017.00
T.	લયવાળા માટે લોગ્લો નકો! નુકશાન કર પછી. (અપવાદકૂપ અને : અથવા આશાપારણ વાનુઓ પછી)	312.77	135.14	105.43	P0.6FE	BOLSE	Trace
H.	સમય પ્રાપ્ત માટે ફુલ સમાહતથી આવદ (તે સમય આવા માટે નહેંડ્યુક્કાનનો સમાવેદ કર પછી) અને અન્ય સમાહતથી આવદ કર પછી		146.00	10C33	306,48	8tY.10	LTIET
1,	दिश्वती क्षेत्र भूती (क्षित्र बेल्यु पु. ६००- प्रति क्षेत्र)	1,440.66	1700.66	TYC5.CC	trence.	1700.66	1440.64
ð.	પુરંમુવ્યાંકન બનાયત સિવાયની બન્ય રેડિવર્ટી		-		14.	-	3141.60
٤	ર્રાદદિક લ્લાલી (દરેક ૧, ૧૦૩૧ ની) ૧, ભૂગમૂન (૭, ૧૯) ૧, ભ્લેલા (૭, ૧૯)	9.61	1.90	Las Las	i.m	431	0.90 5.90

૧. ઉપરાંતન અનમોડિટેડ લ્ડેન્ડપ્યાનેન નાલાડીય પરિણામોની ઓડિટ શર્મિત દ્વારા સમીકા કરવામાં આવી છે અને બોર્ડ પોક ડિરેક્ટર્સ દ્વારા નામી નવેમ્બર રુવર ના રોજ ધોજાવેથી તેમની સંબંધિત બેઠકોમાં મંજુર કરવામાં આવી છે. રુવ્યી શપ્ટેમ્બર રુવર ના રોજ પૂરા થવેલા કવાર્ટર અને અર્પ

વર્ષના આંકડાઓ વૈયાનિક ઑડિટર્સ દ્વારા મર્ચાર્ડિત સમીક્ષાને આયિન છે. ર પાછલા વર્ષોના આંકડાઓ ફરીલી જુલેમના કરવામાં આવ્યા છે અને જરુરી કોલ ત્યાં પુત્રવાગીકાલ કરવામાં આવ્યા છે. ૩. ઉપરોક્ત સેમી (લિસ્ટિંગ અને અન્ય ડિસ્ક્લોઝર રિક્લાચરમેન્ટ્સ) રેગ્યુલેશના, રુલપના નિયમન ૩૩ હેઠળ પીએસઈ સ્ટીક એક્સવેન્જ (પી એસ ઇ) સાથે ફાઇલ કરાવેલ વિમાસિક અને અર્પ વાર્ષિક નાલાકીય પરિલામીના વિગતવાર ફોર્મેટની અર્ક છે. વિમાસિક અને અર્પ વાર્ષિક નાલાકીય પરિવામો નું સંપૂર્વ કોર્મેટ સ્ટોક મેક્સપેન્જનો વેખસાઘટ www.tsainsta.com અને કંપનીની વેખસાઘટ www.champtus.com પર ઉપજન્ય છે.

કેમક્શ એન્ટરપ્રાઇઝીઝ વિમિટેડ વતી સહીઃ ત્રિરીશકુમાર શાહ (હોય ટાઈમ ડિરેક્ટર) તારીખ: ભ્રમી નવેમ્બર સ્વરૂડ

Chola थोलामंडलम र्छन्वेस्टमेन्ट ओन्ड झार्छनान्स झंपनी लिमिटेड Duer a Nemer No કોર્પોરેટ ઓકિસ: ચોલા કેસ્ટ, સુપર બી, સીપાર અને સીપાય, ૪, લીરૂ વી કા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, વિન્ડી, ચેત્રાઈ ૧૦૦૦૦૧ પરિશિવર મ (જુઓ નિયમ ૮(૧)) કબજા નોટીસ (સ્થાવર મિલકત માટે)

મા**ર્થી ચોલામંડલમ ઇન્ટેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની શિમિટેડ**ના અધિકૃત અધિકારી તરીકે નીચે સહી કરનાર, ધી સિક્યોરિટાઈઝેસન એન્ રીક-સ્ટ્રક્શન ઓક કાવના વિલય એસેટ્સ એન્ડ એન્ડકોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (૨૦૦૨ના ૧૪) અને સેક્શન ૧૭(૧૨)ન ધી સિક્ષ્મોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સાથે વેચાલે લેતાં હેઠળ મળેલ સત્તાની રૂએ દેણદાર ને એક દિમાન નોટિસ મોકલી હતી નોટિસમાં જણાવેલ રસ્ય અને તેના પરનું વ્યાજ ઉપરોક્ત નોટિસ મધ્યાની તારીખથી ૧૦ દિવસની અંદર ચુકવવા જણાવેલ. દેશદાર આ રકમ ચુકવવામાં નિષ્કળ રહેલ છે, જેથી દેલદારો અને જાહેર જનતાને આ નોટિસથી જણાવવામાં આવે છે કે નીચે વર્લવેલ મિલકતોનો નીચે સહી કરનારે તેને મળેલ સદર કાયદાના સેક્શનના સબ-સેક્શન (૪) સેક્શન ૧૩ ને ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એનાોર્સમેન્ટ) નિવમો, ૨૦૦૨ના નિવમ ૮ તેકલ મળેલ સતાની રૂમ્ને **૭૯મમે** લીધો છે. દેશદારને વિશેષ રૂપે અને અને જાહેર જનતાને સામાન્ય રીતે સુચિમાં જણાવેલ ચિલકત સાથે વ્યવહાર ન કરવા પૈતવણી આપવામાં આવે છે અને ચિગ્રકત સાથેના કોઈ પણ સોડા પિરાણ. અને તેના પરના વ્યાજ સાથે **મેકાઈ સોલામંકલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ** ફાઈનાના કંપની રિમિટેડના ચાર્જમાં ગણામે. સિલ્પોર્ડ બરકચામનો છોડાવવાની ઉપલબ્ધના સમયમર્યાદા ખેતે સરકેસી કાયદાના સેક્શન ૧૭ના સભ સંસ્થાન (૮) તરક દેવાદારનું ધ્યાન દોરવામાં આવે છે.

देशदारजुं जाम खले सरजायुं स्थले सोज खेशरीजर जं.	કોમાનક નોટીસની લારીખ	cost sew	कव्यभवाणी मिवकतानुं वर्णन	कदम्फानी दाशीम
Loan Air Nos XBHLNES000128957(N વિજયકુમાર સામાસાદ લોકા સેપવાર્ટના શિજયકુમાર લોકા સમાસાદ સામસિંદ લોકા લાકા રહે છે : લોકાવાસ, યુખ્યદ છક, પરાજપુર-૩૮૫૫૩/૫. લાકી પણ : ૧૯મી. યુટ્ટ ગીન સોસાપર્ટી, બોપણ સેદ, ડીસા, બોપણ સેદ, ડીસા-૩૮૫૫૩/૫	4s-03-5053	ટ્રા. વાર,૦૦,૦૪૩ (અંકે ટ્રેપિયા ઓગલપ્રીસ ચાખ સાત હજાર વેતાલીક પુરા)	મિલકતનો તમામ ભાગ અને હિસ્સા સાથે પ્લોટ નં. ૧૯ પી, ના સર્વે નં. ૫/૧, ભોષમ સીમ, તા. ડીસા, જીલ્લો ખનાસકાંઠા, જેનું ક્ષેત્રકળ ૭૮. ૩૭૫ ચો.મી. પ્લોટ નં. ૧૯પી, ગુરૂ ગ્રીન સોસાવીટી, ભોષલ રોડ, તા. ડીસા, જી. ખનાસકાંઠા	04-11-4043
Loan A'c Nee. XOHLME500002359170 દાલુભાઈ કાલુભાઈ તાઈ ગીતાદોના ભાલુભાઈ તાઈ ભાલ રહે છે : હરીજન વાલબુરવ, ખીંમન, ખનામકાંઠા, કિસા -૩૮૫૫૪૫ અહીં પણ : પ્લોટ નં. ૧૨૦ ચુરૂ ચીન સોસાવટે ખોંચવ શેઠ, કિસા, ખોંચવ શેઠ. કિસા-૩૮૫૫૩૫	44-03-4043	ણ. ૨૭,૫૩,૫૮૫/ (અંકે રૂપિયા સત્યાવીસ લાભ ત્રંપન હજાર પાંચલો પંચ્યાસી પુરા)	૧૨૦ સર્વે નં. ૫/૧, બોવલ સીમ, તા.ડીસા, જલ્લો ખનાસકાંઠા, જેનું લેગકળ ૮૬.૫૧ ચો.મી. સીમાઓ સાથે.	04-11-2023 80ml
AT 1 AT 45 3445			and an and and	

dl. 1 04-44-2023 स्थात : डीसा

☞ RATNABHUMI DEVELOPERS LIMITED

CIN: L45200GJ2006PLC048776 Regd. Office: Ratna Corporate House, Near Santsor Bungalows, Ambil. Daskrol, Ahmedabad-380058, Gujarat, India Contact No :+91 87585 51175; | Email:cs@ratnagroup.co.in; | Website: www.ratnagroup.co.in;

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE

(Rupres in Lakhs except EPS)									
Sr. No.	Particulars	Quarter ended 30-09-2023 (Unaudited)	Quarter ended 30-09-2022 (Unaudited)	Half year ended 30-09-2023 (Unaufited)	Year Ended 31-03-2023 (Audited)				
1	Total Income from Operations	22.47	6.35	33.34	21.63				
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	4.87	(14.89)	2.69	(21.73)				
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary (terms)	4.87	(14.89)	2.69	(21.73)				
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	5.45	(14.88)	1.88	(21.08)				
5	Total Comprehensive Income for the period. [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	6.08	11.40	6.24	23.38				
6	Equity Share Capital	1370.00	1370.00	1370.00	1370.00				
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	1.0	14	-	2107.32				
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) – 1, Basic: 2. Diluted:	0.04	0.08	0.05 0.05	0.17				

2. Diluted Rete:

- a) The above is an extract of the detailed format of Quarterly and Half yearly Consplicated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosum Requirements) Regulations, 2015. The full tornal of the Quarterly and half yearly Standalone and Consolidated Financial Results are available on the websites of the Stock Exchange at www.bswindia.com and the company at www.ratnagroup.co.in.
- b) The Turnover for the Quarter ended 30th September, 2023 is ₹ 29.24 takins, Profit before tax is ₹ 5.53 takins and Profit after Tax is ₹ 6.11 takhs on stand-alone basis.

For, Ratnatrhumi Developers Limited, Sd-Kaivan Shah

Chairman and Managing Director DIN: 01887130 Date: 09-11-2023



VADILAL CHEMICALS LIMITED

Regd. Office: 9TH Floor, Colonnade Building, Opp. Isocn Temple BRTS Bus stop, Ambli-Bopal Road, Ahmedabad-380054., CIN: L24231GJ1991PLC015390, EMAIL ID: info.vcl@vadilalgroup.com

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30-09-2023

	(Rs. In Lacs except per share data							
Particulars	Quarter ended on 30-09-2023	Current Year cumulative upto 30-09-2023 (6 months)	Corresponding three months ended on 30-09-2022 in the previous year					
	(Unaudited)	(Unaudited)	(Unaudited)					
Total income from operations (net)	2275.54	4190.57	2107.21					
Net Profit for the Period before tax, Exceptional Items/ Extraordinary Items	158.20	278.55	112,63					
Net Profit for the period before tax	158.20	278.55	112.63					
Net Profit for the period after tax	118.02	207.92	81.41					
Total Comprehensive Income for the Period	115.02	204.34	79.58					
Equity Share Capital	487.40	487.40	487.40					
Earnings Per Share (of Rs. 10 each)								
Basic:	2.42	4.27	1.67					
Diluted:	2.42	4.27	1.67					

Notes:

Date: 9" November, 2023

Place: Ahmedabad

- 1) The above is an extract of the detailed format of Unaudited Financial Results of the Company for the quarter and half year ended on 30-09-2023 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results for the quarter and half year ended on 30-09-2023 are available on Company's website viz www.vadilalchemi-
- The above Unaudited Financial results have been approved by the Board of Directors at its Board Meeting held on 9th November, 2023 and Limited Review of the above results have been carried out by statutory auditor of the company.

FOR VADILAL CHEMICALS LIMITED

Sd/-**DEVANSHU L. GANDHI** DIRECTOR

DISHMAN CARBOGEN AMCIS LIMITED

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Hall Year ended 30-09-2023

CON: L74500G.0007PLC051338 Email ID: grissanusikenatuk.com Web : yourulmakuk.com irman Composite House, Iscon - Segal Road, Arribs, Ahmedatud 360 (E.S. Phone No. 02717-420102/124

			January -		(Rupees in Crores / in Te				
St.	Perfection	For The Quarter exted 30-09-2023	Far The Proceeding Quarter maked 30-64-0503	For The Corresponding Quarter ended 50-69-2022	For The Half Your sweet 30-09-2023	For The Concesponding Half Year coded 30-09-2022	For The Year coded 21-03-2023		
Щ		Describer	Describer	Steadled	Braudioi	Unaudited	futitré		
1	Total Erzama Yrom, agentations (riet)	596.58	721.88	613.96	1,809.57	1,154.5T	2,412.92		
2	Net Profit (Loss) for the period (before Tax. Exceptional and/or Estrantificacy April)	(20.2%)	29.49	(12.29)	(3.72)	(12.5%)	(6.44)		
2	Not Profit(Lissa) for the period before too jather Exceptional and/or Establishers (terms)	(36.26)	25.43	(12:28)	(4.77)	(1238)	(64.90)		
4	Not ProfestLose; for the period after ten- jater Exceptional ancier Extraordinary Items;	(40.00)	17,00	(10:00)	(23.91)	(8.04)	(27.80)		
H	Total Congridiesce Number for the period (Congrising Profit / (Lest) for the period (offer tax) and Other Congressors (scores (offer tax))	(96.52)	57.70	25.41	(38.82)	5:01	200.74		
E.	Equity Share Capital	21.36	2136	3136	31.36	21.36	21.30		
1	Reserves (auticiting revaluation reserve)	100				- Ca	5,776.33		
6	Securities Promote Account	1	- 1		- 3		4,738,76		
9	Net worth	1.0	- 2	-	5,779,81	1.0	3,309.67		
12	Foat up Dest Capital Cetyberdeg Debt	1000			1.560.60	(A)	1,82431		
tt.	Curatanding Reservable Proteonics Shares	NA.	. NA	.546	546	MA.	NA.		
12	Outs Equity Ratio (Number of terror;)	9.34	4.34	-	0.34	100	0.01		
13	Earnings Per Share (of Rs 2)—early (for continuing and discontinued operations)								
	Barc .	(2.81)	1.01	(0.64)	(58.6)	(0.00)	(1.81)		
	Dikeret	(2.01)	1.06	04.0	(5.87)	(0.20)	(1.83)		
14	Cygrital Retemption Reserve		1.40	U Lac		1			
结	Deberturi Rickrepton Reiena	100	560	150	74				
15	Stellat Rennikon Convertage Matter	2.36	. 131		2.86		2.67		
17	Interest Service-Doyerage Audio	4.29	4.20		429	1 1	5.38		

F - Exceptional and/ or Extraordinary Renn adjusted in the Espiercent of Profit and Lois. In accordance with had AS Rules AS Rules, whichever to applicable.

- For the other live items interned in regulation \$2(4) of the SERI (Listing and Other Disclosure Regularization) Regulations, 2515 ("Listing Regulations") perferent disclosures have been made to the Stock Exchange(s) BSE Limited and Rational Stock Exchange of India Limited and can be accessed on the westwinda.com, and www.niprida.com
- The impact on ret profit has, total comprehensive income or any other relevant fissocial library; due to charge(s) is accounting policies shall be disclose By reason of a lootests.
- The Frigural results retardates and consultation have been revenued by the Audit Convolute and tiken on record by the Board of Directors at the meetings held on fifth Movember, 2003. These financial meets plantations and cosmolidated) have been prepared in compliance with red AS as earthwile. 8w Wester of Carporate Affairs and prescribed under Section 130 of the Companies Act, 2013, mat with Intervent rules insuch Terrusidor and other accounting pronouncements generally accepted in India, to the extent applicable.

4. The specified form of the stardwise feature results of the company we given below

apees in Croves / in Ten Million For The For The For The Half Year Year ented ended 21-03-2023 1972 60.55 100.54 TOTAL APPRENTAN

is: [Total Carigratium/ve Income (After Tax) 0.4% The previous suarter / year figures have been re-grouped, re-cast and re-arranged elements' considered recreasive to make it companies The above is an existed of the distalled format of the standakine and consubblished founcial resists for the quarter and fulf year ended September 39, USDS filed with the Stock Exchanges under Regulations 30 and 50 of the SESI (Listing and Other Disclosure Regulations), Regulations 2015 (Listing Regulations), The full formal of the standardne and considerated federald requir the Stock Exchanges without a www.htmmph.com/ and were makindle and an the Congary's widosts www.indust.com

For and on behalf of the board Arpit J. Vyus

adani

Renewables

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ

એકસ્ટ્રા ઓર્ડીનરી જનરલ મિટિંગની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે , અદારી ગ્રીન એનર્જી લિમિટેડના સભ્યોની એક્સ્ટ્રા ઓર્ડીનરી જનરલ મિટિંગ (ઇજીએમ) મંગળવાર, પમી ડિસેમ્બર, સ્ટર્સ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વિડિઓ કોન્ફરન્સ (વીસી) / અન્ય ઓડીઓ વિડિઓ માધ્યમ (ઓએવીએમ) દ્વારા ચોપ્તશે, વેમાં ઇજીએમ નોટિસમાં દર્શાવવામાં આવ્યા મુજબના બિઝનેસ હાથ ઘરાશે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ એફેર્સનાં પરિપત્ર નં. ૧૪/૨૦૨૦, તા. ૮મી એપ્રિલ , ૨૦૨૦ , પરિપત્ર નં. ૧૭/૨૦૨૦ તા. ૧૩મી જાન્યુઆરી , ૨૦૨૧ અને પરિપત્ર નં. ૨૧/૨૦૨૧ તા. ૧૪મી ડિસેમ્બર, ૨૦૨૧ અને SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 અને SEBI/HO/CFD/CMD2/CIR/P/2020/11 તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ (પરિપત્રો) ને ધ્યાનમાં રાખતા, વ્યક્તિગત હાજરી વગર ચોજાણે.

પરિપત્રોને અંતર્ગત પમી ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ ચોજાનાર ઇજીએમની નોટિસ, જે સભ્યોના ઇમેલ કંપની અથવા ડિપોઝીટરી પાસે લોંધાચેલ છે. તેઓને મોકલવામાં આવેલ છે. પરિપત્રો અંતર્ગત છાપેલ નોટિસ મોકલવાની જરૂરીચાત મોકુક રાખવામાં છે. ઇજીએમ બોલાવવા માટેની નોટિસ, કંપનીની વેબસાઇટ www.adanigreenenergy.com तथा नेशनल शिक्योरिटीश डिपोफीटरी विभिटेड (એનએસડીએલ)ની વેબસાઇટ www.evoting.nsdl.com ઉપર પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

કંપનીઝ એક્ટની કલમ ૧૦૮ની જોગવાઇઓ તથા સુધારા સહિતના કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટેશન) રાસ, ૨૦૧૪ના નિયમ ૨૦ તેમજ સિક્યોરીટીઝ એન્ડ એક્સરોન્જ બોર્ડ ઓક ઇન્ડિયા (લિસ્ટીંગ ઓવ્લિગેશન્સ એન્ડ ડિસ્કલો))ર્સ રિક્લાયરમેન્ટ્સ) નિયમો, ૨૦૧૫ના નિયમન ૪૪ અન્વયે. છજુએમની નોટિસમાં વર્ણવવામાં આવેલા તમામ કરાવો ઉપર સમ્યોને તેમનો મત ઇલેક્ટ્રોન્કલી આપવા માટે ઇ-વોર્ટિંગની સુવિધા નેશનલ સિક્ચોરિટી ડિપોઝીટરી લિમિટેડ (એનએસડીએલ) મારક્તે પૂરી પાડવામાં આવેલ છે. મતના અધિકારો શુક્રવાર, 3જી નવેમ્બર, ૨૦૨૩ રોજની સ્થિતિ મુજબ રહેલા શેર્સની સંખ્યાના આધારે પ્રમાણસર ગણાશે, કે જે કટ-ઓફ તારીખ છે.

को डोए सक्य से ए-मेव नोंधरी इसवेव नथी, तो नीये दशविव सुराना सनुसार वोग-एननी विञती મેળવી શકે છે.

- અ. ફિઝીકલ શેર ઘરાવતા સભ્યો માટે જરૂરી વિગતો જેમ કે ફોલિઓ નં., શેરઘારકનું નામ, શેર સર્ટિફિકેટની સ્કેલ કોપી (આગળ અને પાછળ), પાન (સ્વ. પ્રમાશિત પાનકાર્ડ ની કોપી), આઘાર (સ્વ. પ્રમાણિત આઘાર કાર્ડની કોપી) કંપનીના ઇ-મેલ investor.agel@adani.com ઉपर भोडलवा.
- બ. Demat માં શેર ઇરાવતા શેર ઇારકો જે-તે ડિપોઝીટ પાર્ટિસીપન્ટ પાસે ઇ-મેલ નોંધણી કરાવી શકે છે અથવા investor.agel@adani.com ઉપર DPID-client ID, બામ, Client Master, સ્વપ્રમાણિત પાન તથા આધારની કોપી મોકલાવી કરાવી શકે છે.

ડિમેટ અથવા ફિઝીકલ શેર ધારકો પોતાનો વોટ ઇલેક્ટ્રોનીકલ આપી શકે છે. સમ્ચોને એ પણ જણાવવામાં આવે છે કે.

- અ. નોટિસમાં વર્શવવામાં આવેલ તમામ બિઝનેસ, ઇલેક્ટ્રોનીક વોટિંગ દ્વારા જ હાથ ઇરવામાં
- બ. રિમોટ ઇ-વોર્ટિંગ શુક્રવાર ૧લી ડિસેમ્બર, ૨૦૨૩ના સવારે ૯.00 વાગે શરૂ થશે.
- રીમોટ ઇ-વોટિંગ સોમવાર ૪થી ડિસેમ્બર, ૨૦૨૩ના સાંજે ૫:૦૦ વાગે પૂર્ણ થશે.
- ડੀ. 'ਕੇ ਕਰਤਿੰਗ ਜੀਟਿਲ ਮੀਤਵਗ ਪਾਈ ਲਵਕ ਯਜੇ છੇ ਅਜੇ ਤਣ ઓફना ਵਿਧਲੇ ਕੋਲੀ ਬਣਾਹੇ છે, तेओ evoting@nsdl.com અથવા investo.agel@adani.com ઉપર મેલ કરીને લોગ ઇન ਰੂਬਾ ਪਾਲਕੁਤ ਮੈਲਕੀ ਅਤੇ છੇ. ਲਾਮਣ, ਐ ਰੇઓ ਪਣੇਕੋਬੀ ਜੀਂਬਾਬੇਕ છે, ਗੇ ਨੁਕਜ਼ਾ ਕੀਮ ਖ਼ੁਜ਼ ਅਜੇ પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે.
- ઇ. ઉપર દર્શાવેલ સમય પૂર્ગ થતા એનએસડીએલ દ્વારા લોટિંગ બંધ કરી દેવામાં આવશે અને તે બાદ સભ્યો ઇલેક્ટ્રોનીક વોટ કરી શકશે નહી.

એક. એક વાર Resolution પર વોટ કર્યા પછી , તેઓ હેરફાર કરી શકશે નહીં .

- જુ. જે સમ્યોએ રિમોટ-ઇ-વોર્ટિંગ કરેલ છે, તેઓ ઇજીએમમાં ઠાજર રહી શકે છે, પરંતુ ઇજીએમ દરમ્યાન વોટ કરી શકશે નહીં.
- એચ. જે સભ્યોએ પહેલેથી વોટ કરેલ નથી અને ઇજીએમમાં ફાજર છે, તેઓ ઇજીએમમાં ઇ-વોર્ટિંગ હારા વોટ આપી શકે છે.

ઇ-વોર્ટિંગ માટે જો આપના કોઇ સવાલ હોય તો સમ્યો તે માટે www.evoting.nsdl.com ઉપર હેલ્થ એક્શનમાં (ફિક્વન્ટલી આસ્કડ ક્વેશ્વન્થ - FAQs) (અવારનવાર પુણતા પ્રશ્નો) અને ઇ-વોર્ટિંગ મેન્યુઅલનો ઉપયોગ કરી શકે છે અથવા evoting@nsdl.co.in પર ઇ-મેઇલ કરી શકે છે અથવા ટોલ કી નંબર: ૧૮૦૦-૧૦૨૦-૯૯૦ પર ફોન કરીને <u>ભાગકારી મેળવી શકે છે. ઇ-વોર્ટિંગને લ</u>ગતી કોઇ પણ ફરિયાદ હોય तो , सरीता भोटें , नेशनલ સિક્ચોરીટીઝ ડિપોઝટરી લિમિટેડ , ટ્રેડ વર્લ્ડ , એ-વિંગ , ચોથો માળ , કમલા મિલ્સ કમ્પાઉન્ડ, સેનાપતિ બાચટ માર્ગ, લોવર પરેલ (પૂર્વ), મુંબઇ - ૪૦૦૦૨૩ નો સંપર્ક ઇ-મેલઃ evoting@nsdl.co.in પર અથવા ઉપરોક્ત ટોલ ક્રી નંબર ઉપર કરી શકાશે.

દાજુએમને લગતી માહિતી કંપનીની વેબસાઇટ www.adanigreenenergy.com એમએસડીએલની વેબસાઇટ evoting@nsdl.com તથા સ્ટોક એક્સરેન્જની વેબસાઇટ www.bseindia.com તથા www.nseindia.com ઉપર પણ ઉપલબ્ધ છે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વતી,

ENHERGIE

પ્રક્રોશ દરજી

રજીસ્ટર્ડ ઓક્સિ: "અદાણી કોર્પોરેટ હાઉસ", શાંતિસામ, વૈષ્ણોદેવી સર્કલ પાસે, એસ. જી. હાઈવે, ખોડિસાર, अमहावाह - उटरप्रस्य, शुक्रशत, भारतः क्षेत्रः +त्य-क्ट-स्ट्यह् प्रथ्यय । केंक्सः +त्य-क्ट-स्प्य्य प्रयान ดังสะเรีย: www.adanigreenenergy.com | สโซเเยียสะ: L40106GJ2015PLC082007